

## કાળ કોઈને નહીં મૂકે

(હરિગીત)

મોતીતણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી,  
હીરાતણા શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી;  
આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને,  
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૧.

મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા,  
કાંચન કડાં કરમાં ધરી, કશીયે કયાશ ન રાખતા;  
પળમાં પડ્યા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખોઈને,  
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૨.

દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિક્યથી,  
જે પરમ પ્રેમે પેરતા પોંચી કળા બારીકથી;  
એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને,  
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૩.

મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે,  
કાપેલ રાખી કાતરા હરકોઈનાં હૈયાં હરે;  
એ સાંકડીમાં આવિયા છટક્યા તજી સહુ સોઈને,  
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૪.

છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા,  
બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા;  
એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહોતા હોઈને,  
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૫.

જે રાજનીતિ નિપુણતામાં ન્યાયવંતા નીવડ્યા,  
અવળા કુર્યે જેના બધા સવળા સદા પાસા પડ્યા;  
એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સૌ ખોઈને,  
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૬.

તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા,  
હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા;  
એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને,  
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭.

\* \* \*